

નવી કોર્ટ બીલ્ડીંગના પરીસરમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર છેલ્લા ૦૯ મહીનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી, સુરત શહેર કાઇમ બ્રાંચ.

સુરત શહેર વિસ્તારમાં ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ તેમજ પેરોલ/ફર્લો જમ્પ, પોલીસ જાપ્તા ફરાર આરોપીઓને સત્વરે પકડી પાડવા ડી.સી.બી.પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી કામગીરીમાં હતા દરમ્યાન પો.સ.ઈ. પી.કે.પટેલ નાઓની ટીમના હે.કો.શબ્બીર અકબર અને પો.કો.મનોજ તુકારામનાઓને મળેલ હકીકત આધારે પાંડેસરા પત્રકાર કોલોની પાસે રોડ ઉપરથી આરોપી:-અજય ઉર્ફે રવીન્દ્ર s/o રાજેન્દ્રકુમાર પટેલ (કુણબી) ઉ.વ.૨૪ ધંધો-કેન્ટીનમાં મજૂરી રહે. હાલગામ. આસોજ પારસ વિહારધામ બાલાજી કેન્ટીનના ભાડાના રસોડામાં તા.વાઘોડીયા જી.વડોદરા. મુળરહે.ગામ. રેઝુવાખુર્દ થાના.ગુડ જી.રીવા.(મધ્યપ્રદેશ).નાને પકડી પાડી સદર આરોપી ઉમરા પો.સ્ટે. ॥ ગુ.ર.નં-૩૬૦/૨૦૧૮ ઈ.પી.કો.ક. ૨૨૪, ૨૨૫, ૧૧૪ મુજબના કામે હકીકત એવી છે કે, આરોપીની ખટોદરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૪૮/૨૦૧૮ ઈ.પી.કો.ક.૩૯૪,૧૧૪ મુજબના ગુનામાં ધરપકડ થયેલ હતી તેને તા. ૦૯/૧૨/૨૦૧૮ ના રોજ મુદત અંદર કોર્ટમાં રજૂ કરવા સારૂ ખટોદરા પો.સ્ટે.ના સેકન્ડ મોબાઈલ વાનના ઈન્ચાર્જ અ.પો.કો.ધનશીભાઈ વાલીયાભાઈ નાઓને આરોપીનો કબજો સોંપવામાં આવેલ હતો. દરમ્યાન તા.૦૯/૧૨/૧૮ ના ક.૧૬/૧૫ થી ક.૧૬/૩૦ દરમ્યાન કોર્ટ પરીસરમાં પોલીસ વાનમાંથી આરોપીઓને નીચે ઉતારી રહેલ હતા તે વખતે ઉપરોક્ત આરોપી પોલીસ જાપ્તામાંથી નજર ચુકવી નાસી ગયેલ હતો. જે બાબતે ઉમરા પો.સ્ટે.માં ઉપરોક્ત નંબર અને કલમથી પોલીસ વાનના ઈન્ચાર્જ અને જાપ્તામાંથી નાસી ગયેલ આરોપી અજય ઉર્ફે રવીન્દ્ર પટેલ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર થયેલ હતો. સદર જાપ્તા ફરાર આરોપીને પકડી પાડવા સારૂ પેરોલ ફર્લો સ્કોડનાં પોલીસ માણસોએ સુરત શહેરમાં રહેતા આરોપીના મિત્રો અને તેના સાગરીતો વિશે માહિતી મેળવી તેમની પુછપરછ કરી અવર નવર આરોપીના મિત્રો ઉપર વોચ કરેલ અને સદર જાપ્તા ફરાર આરોપીના વિશે માહિતી મેળવતા તે વડોદરા જીલ્લામાં વાઘોડીયા તાલુકામાં આવેલ આસોજ ગામમાં પારસ વિહારધામ ખાતે કેન્ટીનમાં કામ કરતો હોવાનું અને મહીનામાં કોઈક વખત સુરત શહેરમાં તેના મિત્રોને પાંડેસરા પત્રકાર કોલોની પાસે મળવા આવતો હોવાનું જણાય આવેલ હતું જેથી પોલીસ માણસોની ટીમ વડોદરા ખાતે પણ જઈ તપાસ કરેલ પરંતુ ત્યાં કોઈ ફળદાયક હકીકત મળી આવેલ ન હતી. જેથી સદર આરોપીની પાંડેસરા પત્રકાર કોલોની ખાતે અમુક વખત આવતો હોવાની હકીકત આધારે ત્યાં વોચ રાખેલ હતી દરમ્યાન આજરોજ આરોપી પત્રકાર કોલોની પાસે તેના મિત્રોને મળવા આવતા તેને પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.